

Rheumatology

Dose Joint pain makes your life worse?

Patient Awareness Book

શું સાંધાનો દુખાવો તમારું જીવન વધુ કષ્ટદાયી બનાવે છે?

દર્દી જગ્યાતિ પુસ્તક

રૂમેટોલોજી

રૂમેટોલોજી એટલે ‘વા’. સંધિવા અને સાંધા. સ્નાયુઓ અને અસ્થિબંધનનાં અન્ય પિકારોનો અભ્યાસ. આ દવાની એક શાખા છે, જે સંધિવાના રોગોના નિદાન અને ઉપચાર ને સમર્પિત છે. સંધિવા એટલે એવો કોઈપણ રોગ જેમાં સાંધા, સ્નાયુઓ અથવા તંતુમય પેશીઓમાં સોજા અને દુખાવાના ચિનહોળો જોવા મળે, જેમ કે રૂમેટોઇડ આર્થરાઇટિસ રૂમેટીક (સંધિવા) રોગો મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ ને લગતા રોગો છે. જે નરમ પેશીઓ, સ્વયંપ્રતિરક્ષા (ઓટોઇડિયુન) રોગો, વાસ્ક્યુલિટાઇડસ અને વારસાગત કનેક્ટિવ પેશીઓના પિકાર છે.



Joints





Muscles



Ligaments

મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ :

મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમને એ સ્નાયુઓ કંડરા (ટેનન્સ) અસ્થિબંધન, હાડકા અને સાંધાઓની સિસ્ટમ છે. જે સાથે મળીને શરીરની ગતિવિધીઓનું કાર્ય કરે છે.



મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમનો ઉદ્દેશ :

- સ્નાયુ પેશી શરીરમાં હિલચાલ (હલનચલન) ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તેમ છતાં હલનચલન ઉત્પન્ન કરવા માટે સ્નાયુઓને હાડકાના માળખા સાથે જોડેલા રહેવાની જરૂર છે.

- હાડપિંજરના હાડકાં સ્નાયુઓને જોડવા માટે એક માળખું પ્રદાન કરે છે, જેથી હલનચલન શક્ય બને છે.
- હાડપિંજર શરીરની ખાસ કરીને હૃદય, ફેંસા અને મગજ જેવા નરમ અને નાજુક અંગોની સુરક્ષા પણ કરે છે.

મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમના ઘટકો :

૧. સ્નાયુઓ :


- સ્નાયુઓ આપણાને બિજે જવાની મંજૂરી આપે છે, કારણ કે તે સંકોચાવામાં (ટ્યુંકા થવામાં) અને પિસ્તરણા (લાંબા થવામાં) સર્જી છે.

૨. હાડકાં :

- હાડકાં શરીરને આકાર આપવામાં સહાય અને મદદ પ્રદાન કરે છે.

૩. સાંધા :

- જથું હાડકાં મળે છે તેને સાંધો કહેવામાં આવે છે. ઘૂંઠણ અથવા કોણીનો સાંધો અથવા આંગળી અને પગના સાંધા.



સાંધાના પ્રકારો :

સાંધાની શરીરરચના :



● આર્ટિક્યુલર / હાઇલિન કાલ્ટિલેજ

- આંચકા શોષક તરીકે કાર્ય કરે છે.
- ધર્ષણા - મુક્ત હલનયલન માટે અનુમતિ આપે છે.
- જગ્યાત નથી !

૪. કાલ્ટિલેજ (Cartilage):

- કાલ્ટિલેજ સખત હોવા છતાં લવચીક (ફ્લેક્સીબલ) છે અને તે સાંધાના હાડકાં, પાસળી અને સ્ટનના હાડકાની વચ્ચે જોવા મળે છે. તે કાન, નાક અને શ્વાસનળીની નળીઓ પણ બનાવે છે અને કરોડજુના હાડકાં વચ્ચે ડિસ્ક પણ બનાવે છે.

૫. કંડરા (Tendons):


- તમારા સ્નાયુઓ હાડકાં સાથે મજબૂતકોર્ડ્સ (રજજુ) થી જોડાય છે જેને કંડરા (Tendons) કહેવામાં આવું છે ઉદાહરણ તરીકે તમારા પગની દૂંઠી પાછળ (જેને એથ્યુલિસ ટેંડોન કહેવામાં આવે છે.)

૬. અસ્થિબંધન (Ligaments):

- અસ્થિબંધન હાડકાં વચ્ચે સાંધામાં હોય છે અને સાંધામાં હાડકાને એકસાથે પકડી રાખે છે. તે અત્યંત મજબૂત હોય છે.

નરમ પેશી (Soft Tissue):

નરમ પેશી એ એવી પેશી છે કે જે શરીરના અન્ય બંધારણો અને અવયવોને જોડે છે, ટેકો આપે છે અથવા તેને આવરે છે. નરમ પેશીઓમાં સ્નાયુઓ, કંડરા, અસ્થિબંધન, ફેસિયા, ચેતા, તંતુમય પેશીઓ, ચરબી, રકત વાહિનીઓ અને સાથનો ધિયલ મેઝબેનનો સમાવેશ થાય છે.



સ્વયંપ્રતિરક્ષા (Autoimmune Disease)

સ્વયંપ્રતિરક્ષા રોગ એ એવી સ્થિતિ છે જેમાં તમારી રોગપ્રતિકારક તંત્ર ભૂલથી તમારા શરીર ના કોઈ ભાગ જેવા કે, સાંધા અથવા ચામડી ને ભૂલ થી બહારની વસ્તુ સમજૂ તેના પર હુમલો કરે છે જેનાથી તે ભાગને નુકશાન થાય છે. તે સ્વસ્થ કોષો પર હુમલો કરનારા ઓટોઅન્ટિબોડીઝ નામના પ્રોટીન સ્ત્રાપિત કરે છે.




રૂમેટિક (સંધિવા) રોગો ને સોજા દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે, જે શરીરના જોડાણ અથવા સહાયક રચનાઓને અસર કરે છે. સામાન્ય રીતે સાંધા, પરંતુ કયારેક કંડરા, અસ્થિબંધન, હાડકાં અને સ્નાયુઓને પણ અસર કરે છે. કેટલાક સંધિવા રોગો અંગોને પણ અસર કરે છે.



કયારેક રૂમેટિક રોગોને મસ્ક્યુલોસ્કેલેટલ રોગો કહેવામાં આવે છે. સામાન્ય લક્ષણોમાં નીચેના સામેલ છે.

- સાંધાનો દુખાવો
- સાંધા અથવા સાંધાઓમાં ગતિનો અભાવ
- સોજા-સાંધા અથવા અસરગ્રસ્ત પિસ્તારમાં બળતરા (સોજો), લાલાશ અને ગરમાહાટ.

૧૦૦ થી વધુ સંધિવાના રોગો અસ્થિતવમાં છે. તેમાંથી કેટલાક નીચે મુજબ છે. રૂમેટિક રોગોના પ્રકાર



કેટલાક સૌથી સામાન્ય રૂમેટિક રોગોમાં સામેલ છે.

- આર્થોપેથી એ સાંધાનો રોગ છે. સંધિવા એ આર્થોપેથીનો એક પ્રકાર છે જેમાં એક અથવા વધુ સાંધામાં થતી બળતરા (સોજા) સામેલ હોય છે. જ્યારે આર્થોપેથી શબ્દનો ઉપયોગ સોજો હોય કે નહીં તે દ્યાનમાં લીધા વગર થાય છે.
- સ્પોન્ડોલોઆર્થોપેથી એ કરોકરજજુ (વર્ટીબ્રિલ કોલમ) ની આર્થોપેથીનો પ્રકાર છે.
- આર્થ્રિલ્યુઆ (સાંધાનો દુખાવો) સામાન્ય છે પરંતુ એ આર્થોપેથીનો બિન-પિશિષ્ટ સંકેત છે.

* આર્થરાઈટિસ (વા) :

- “આર્થર” (Arthr) નો અર્થ ‘સાંધો’ અથવા આર્ટિક્યુલર અને “આઈટીસ” (Itis) નો અર્થ (બળતરા) છે. ટૂંકમાં, એક અથવા વધુ સાંધાનો સોજો. જે પીડા અને જડતાનું કારણ બને છે અને જે વચ્ચે સાથે વધુ વકરે છે. આર્થરાઈટિસ, સંધિવા તરીકે પણ ઓળખાય છે.



- આર્થરાઈટિસ એ કોઈ એક રોગ નથી. તે પરિસ્થિતિઓનો એક સમૂહ છે. જેમાં શરીરના સાંધાઓ સોજેલા અને પીડાદાયક હોય છે. સાંધાઓ વચ્ચેની કાર્ટિલેજ તૂટી જાય છે જેના કારણે હાડકાં એકબીજા સાથે ઘસાય છે જે ખૂબ જ પીડાદાયક હોય.

Common types of Arthritis




* અસ્થિવા (ઓર્ટીઓ આર્થરાઈટિસ) :

- અસ્થિવાને ડીજનરેટિવ આર્થરાઈટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સૌથી પ્રચલિત પ્રકારનો સંધિવા છે. જે મુજયાત્યે કાર્ટિલેજને

અસર કરે છે અને તેનો નાશ કરે છે. કાર્ટિલેજ એ નરમ પેશી છે જે સાંધાની અંદર હાડકાઓના અંતને ગાઈ આપે છે.


- આપણી ઉંમર જેમ વધે તેમ તે વારંવાર થાય છે. ૪૫ વર્ષની ઉંમર પણેલા, પુરુષોમાં અસ્થિવા વધુ વખત થાય છે. ૫૫ વર્ષની વચ્ચે પણી, તે સ્ત્રીઓમાં વધુ વાર જોવા મળે છે.
- અસ્થિવા સામાન્ય રીતે હાથ, પગ, કરોકરજજુ અને વધુ વજન-સહન કરતા સાંધા, જેમ કે નિતંબ અને ઘૂંઠણને અસર કરે છે.
- કાર્ટિલેજ કુશન (ગાઈ) ગુમાવવાથી હાડકાં વરચે ધર્ષણ થાય છે. જેનાથી પીડા થાય છે.



* રૂમેટોઇડ આર્થરાઈટિસ :

- રૂમેટોઇડ આર્થરાઈટિસ (RA) એ એક જૂની સ્વયંપ્રતિરક્ષા પિકાર છે, જે સાધારણ સાંધાની સોજા છારા વગ્નિકૃત થયેલ છે.
- રૂમેટોઇડ આર્થરાઈટિસમાં, રોગપ્રતિકારક શક્તિ ભૂલથી સાગનોધિયમ પર હુભલો કરે છે અને તે સામાન્ય રીતે ગરભ, સોજેલા અને પીડાદાયક સાંધામાં પરિણામે છે. ઘણીવાર આરામ કર્યા પણ પીડા અને જૂડતા વધુ વકરે છે. કાંડા અને હાથ સામેલ હોય છે.

સામાન્ય રીતે શરીરની બંને બાજુઓ પર સમાન સાંધા સામેલ હોય છે.




* સ્પોન્ડિલોઆર્થોપેથી :

- સ્પોન્ડિલોઆર્થોપેથીને સ્પોન્ડિલોઆર્થ્રાઈટીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંધિવાનો પ્રકાર જે સામાન્ય રીતે તમારા કરોડરજજુ અને નજીકના સાંધામાં હાડકાં પર પ્રહાર કરે છે. તથો પીડા, બળતરા (સોજા) અને ઘણી વખત તમારા કરોડરજજુ, ખબા, અને નિતંબ જેવા સાંધાઓને પણ નુકશાન પહોંચાડે છે. જેમ લોકોની ઉંમર વધે તેમ આનું થયું સામાન્ય છે.
- તેમાં એન્ડીલોકિંગ સ્પોન્ડિલાઈટીસ, રિએક્ટીવ આર્થ્રાઈટીસ, સોરીયાટીક આર્થ્રાઈટીસ અને ઈન્ફલેમેટરી બોવેલ ડિસીઝ (અંટોરોપેથીક આર્થ્રાઈટીસ) સાથે જોડાયેલી સાંધાની સામરચ્યાઓ સામેલ છે.


* એન્ડીલોકિંગ સ્પોન્ડિલાઈટીસ :

- એન્ડીલોકિંગ સ્પોન્ડિલોઆર્થ્રાઈટીસ (AS) એ સૌથી સામાન્ય સ્પોન્ડિલોઆર્થોપેથી છે. જે સંધિવાનો એક પ્રકાર છે. જે મુજયત્વે કરોડરજજુને અસર કરે છે. જોકે અન્ય સાંધાઓ તેમાં સામેલ થઈ શકે છે. તે કરોડરજજુના સાંધા (વર્ટીબ્રિ) ના સોજાનું કારણ બને છે. જે ગંભીર, લાંબી પીડા અને અગવડતા તરફ દોરી શકે છે.



* રિએક્ટીવ આર્થ્રાઈટીસ :

- રિએક્ટીવ આર્થ્રાઈટીસ અથવા રેટેટર સિન્ક્રોમ એ તમારા શરીરના બીજા ભાગ જેવા કે આંતરડા, જનનાંગો અને મૂત્ર માર્ગમાં થયેલ ચેપ દ્વારા થતો સાંધાનો દુખાવો અને સોજો છે. તે એક સ્પોન્ડિલો આર્થોપેથી છે જે મૂત્ર માર્ગ, આંતરડા અથવા અન્ય અવયવોના ચેપ પછી પિકસે છે.
- રિએક્ટીવ આર્થ્રાઈટીસ સામાન્ય રીતે તમારા ધૂંટણ અને પગની ધૂંટીઓ તથા પગના સાંધાને નિશાન બનાવે છે.



* સોરીયાટીક આર્થ્રાઈટીસ :

- તે આર્થ્રાઈટીસનો એક પ્રકાર છે અને સ્પોન્ડિલોઆર્થોપેથી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે આંગળીઓ અને અંગૂઠાને અસર કરે છે અને ત્વચા રોગ સોરીયાસીસ (Psoriasis) સાથે સંકળાયેલ છે.




* એટોરોપેથિક આર્થ્રાઈટીસ :

- એટોરોપેથિક આર્થ્રાઈટીસ અથવા EnA એ જદરાંત્રિય (GI) પેથોલોજીઝની શ્રેણી સાથે સંકળાયેલ કોનિક, ઈન્ફલેમેટરી સંધિવાનો એક પ્રકાર છે. તે સ્પોન્ડિલોઆર્થોપેથી તરીકે પણ ઓળખાય છે. ઈન્ફલેમેટરી બોવેલ ડિસીઝ (IBD) આર્થ્રાઈટીસ થવાના બે સૌથી જાણીતા પ્રકારો છે જેમાં અલ્સેરેટિવ કોલાઈટીસ અને કોહન રોગ સામેલ છે.


* જુવેનાઇલ આઇડિયોપેથિક આર્થ્રાઈટીસ :

- જુવેનાઇલ આઇડિયોપેથિક આર્થ્રાઈટીસ (JIA) જે અગાઉ જુવેનાઇલ ઝુમેટોઇડ આર્થ્રાઈટીસ તરીકે ઓળખાય છે તે ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સૌથી સામાન્ય પ્રકારનો સંધિવા છે.
- બાળકોમાં સંધિવાનું સૌથી સામાન્ય સ્વરૂપ જે માં તાપ અને ફોલ્ટીઓ સાથે થઈ શકે છે. તે છોકરીમાં થોડો વધારે પડતો જોવા મળે છે. સામાન્ય રીતે પ્રી સ્ક્લુલના બાળકો અથવા કિશોરોમાં થાય છે. તેનાથી સાંધાનો સતત દુખાવો, સોજો અને જકડતાં થાય છે.




* ઇન્ડેક્શનસ આર્થરાઈટીસ (ચેપી સંધિવા) :

- ચેપી સંધિવા જેને સેપ્ટિક સંધિવા પણ કહેવામાં આવે છે. તે સંધિવાનો એક પ્રકાર છે. જે સાંઘામાં ચેપને કારણે થાય છે. તે ચેપ બેક્ટેરિયલ, વાયરલ અથવા ફુંગલ ઇન્ડેક્શનની થાય છે જે શરીરના અન્ય ભાગમાંથી ફેલાય છે. ચેપી સંધિવાનાં લક્ષણોમાં સાંઘામાં તીવ્ર પીડા, સાંઘાની લાલાશ અને સોજો સામેલ છે.




* ગાઉટ (વાતરકત) :

- ગાઉટ ને “ગાંઠિયો વા” કે “વાતરકત” કહેવાય છે. જે ગાઉટી આર્થરાઈટીસ તરીકે પણ ઓળખાય છે. ગાઉટ એક પ્રકારનો ઇન્ફલેમેટરી આર્થરાઈટીસ છે. જે ઘણા લોકોમાં વૃદ્ધિ પામે છે. જેઓના લોહીમાં ચુરીક એસિટનું પ્રમાણ વધારે હોય છે. ચુરીક એસિડ સાંઘામાં સોથ જેવા કિસ્ટલ બનાવે છે. તે સાંઘામાં પીડા, નરમાશ, લાલાશ, ગરમાહટ અને સોજાના અચાનક અને તીવ્ર દુઃખાવાનું કારણ બને છે.




* સ્યુટોગાઉટ :

- સ્યુટોગાઉટ (અથવા “ફોલ્સ ગાઉટ ખોટો ગાંઠિયો વા”) એ એક સંધિવાનો એક પ્રકાર છે. જે કેલિશામ પાયરોફોસ્ફેટ કિસ્ટલના ડિપોરીશનની પરિણમે છે. તેથી તેને કેલિશામ પાયરોફોસ્ફેટ ડિલાઇફ્રોટ કિસ્ટલ ડિપોરીશન ડિસીસ અથવા CPPD તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સામાન્ય રીતે ધૂંટણ અને કાંડાને અસર કરે છે.



* ટેનિનાઈટીસ :

- ટેનિનાઈટીસ એટલે કંડરા (tendon - ટેનન) નો સોજો અથવા બળતરા કંડરા એટલે જાડો તંતુમય કોર્ક જે સ્નાયુઓને હાડકાં સાથે જોડે છે. આ પસ્઱રિથિત સાંઘાની બહાર પીડા અને નરમાશનું કારણ બને છે. ટેનિનાઈટીસ કોઈપણ કંડરા (ટેનન્સ) માં થઈ શકે છે. જે સામાન્ય રીતે ખલા, કોણી, કાંડા, ધૂંટણ અને એડીની આસપાસ હોય.



* લ્યુપસ :

- લ્યુપસ, સિસ્ટેમિક લ્યુપસ એરિથમેટોસસ (SLE) તરીકે પણ ઓળખાય છે. એક સ્વયંપ્રતિરક્ષા પિકાર જે સાંઘા, ત્વચા, કિંડની, લોહી, ફેફસા, હૃદય અને મગજ સહિથ શરીરના અસંખ્ય ભાગોમાં બળતરા (સોજો) પેદા કરે છે.
- SLE સમય શરીરમાં પેશીઓને અસર કરે છે. પુરુષો કરતા સ્ત્રીઓમાં પ્રમાણમાં પાંચ ગણી વધુ SLE થાય છે. મોટાભાગના લોકોમાં ૧૫ થી ૪૦ વર્ષની વય વચ્ચે આ રોગ પિકસે છે. જો કે તે કોઈપણ ઉંમરે દેખાઈ શકે છે.
- લ્યુપસમાં સાંઘાનો દુઃખાવો, જકડન અને સોજો આવે છે અને ચહેરા ઉપર ગાલના ભાગમાં પતંગિયાની પાંખોના આકારમાં કેટલાક ભાગ લાલ થઈ જાય છે. શરીરનું અમુક પ્રકારનું જનીન બંધારણ જયારે અમુક પરિબળોનાં સંપર્કમાં આવે છે. ત્યારે લ્યુપસ થવાની શક્યતા વધી જાય છે. જેમ કે, સૂર્યપ્રકાશની હાજરી કેટલાક ઇન્ડેક્શન અને કેટલાંક રોજિંદા લેવી પડતી દવાઓથે લ્યુપસનાં લક્ષણો શરૂ થાય છે અથવા વધી જાય છે.




* સ્કલેરોડમા :

- સ્કલેરોડમા અથવા સિસ્ટેમિક સ્કલેરોસિસ એ એક લાંબી અને પ્રગતીશીલ ત્વચા અને કનેક્ટિવ પેશીનો રોગ છે. જે સામાન્ય રીતે ઓટોઇઅનુન રૂમેનિક રોગમાંનો એક રોગ છે. “સ્કલેરોડમા” શાંદ બે ગ્રિક શબ્દોમાંથી આવે છે : “સ્કલેરો” એટલે હાર્ડ (કઠળા)ન અને “ડમ્ની” એટલે ચામડી (ત્વચા).
- તે રક્ત વાખિનીઓ, સાંધારો અને ચોક્કસ અંગો સહિત ત્વચા અને કનેક્ટિવ પેશીઓ લાંબા સમય સુધી કઠળા અને કડક બનાવે છે.



* પોલીમાયોસાઈટિસ :

- પોલીમાયોસાઈટિસ એ ઈન્ફલેમેટરી માયોપેથી રોગ છે. જે સ્નાયુ રોગનો એક સમૂહ જેમાં એક કરતાં વધારે અથવા સંકળાયેલ પેશીઓમાં સોજા આવે છે. માયોપેથી એ એક સ્નાયુ રોગ છે અને સોજા આવવા એ કોષના નુકશાનની પ્રતિક્રિયા છે જે આખા શરીરને અસર કરી શકે છે.



* ડર્મેટોમાયોસાઈટિસ :

- ડર્મેટોમાયોસાઈટિસ એ ઈન્ફલેમેટરી માયોપેથી (સ્નાયુ પેશીઓ અથવા સ્નાયુઓનું ધિકાર) કહેવાતા સ્નાયુ રોગના સમૂહમાંનો એક રોગ છે. જ. જ. સ્નાયુઓની નબળાઈ ના લીધે સ્નાયુઓમાં લાંબા સમય માટે સોજા આવે છે. જે ત્વચા પર જોવા મળે છે. તેના મુખ્ય લક્ષણોમાં સ્નાયુઓની નબળાઈ વધવાની સાથે ત્વચા પર ફોલ્ટીઓ થાય છે.



* પોલીમાયોલ્જીયા રૂમેનિક :


- પોલીમાયોલ્જીયા રૂમેનિક એક ઈન્ફલેમેટરી ધિકાર છે. જે સ્નાયુઓમાં દુઆવો અને જડતાનું કારણ બને છે. જે ખાસ કરીને ખભામાં થાય છે. તે સાંધારી આજુબાજુના કંકરા, સ્નાયુઓ, અન્તિથબંધન અને પેશીઓમાં પણ પીડા અને જડતાનું કારણ બને છે.
- તેના ધ્યાનો અને લક્ષણો સામાન્ય રીતે ઓચિંતા શરૂ થાય છે અને સ્થિતિ સવારે વધુ ખરાબ હોય છે. મોટાભાગે પોલીમાયોલ્જીયા રૂમેનિક મોટી ઉંમરમાં ધિકસે છે. જેમની ઉંમર કપ વર્ષથી વધુની હોય છે.



* ફાઈબ્રોમાલ્જીયા :


- ફાઈબ્રોમાલ્જીયા એ એક ધિકાર છે. જે વ્યાપક ફેલાયેલ મસ્ક્યુલોસ્કેલેટલ (સ્નાયુઓ અને હાડકાંમાં) પીડા, જેમાં સ્નાયુઓમાં પીડા, નરમાશ, થાક, નિંદ્રા, સમરણાશક્તિ અને મૂડના ને લગતી મુશ્કેલીઓ થાય છે. ફાઈબ્રોમાયોલ્જીયા જેને ફાઈબ્રોમાલ્જીયા સિન્ડ્રોમ્સ (FMS) પણ કહેવામાં આવે છે. તે

એક લાંબા ગાળની સ્થિતિ છે, જેનાથી આખા શરીરમાં પીડા થાય છે. તે સાંદ્યાને નહીં પણ નરમ પેશીઓને પણ અસર કરે છે.



* વેસ્ક્યુલાર્ટીસ :

- વેસ્ક્યુલાર્ટીસ એ તમારી રકતવાહિનીનો સોજો છે. તે રકતવાહિનીઓના દિવાલોમાં પરિવર્તનનું કારણ બને છે. જે જાડાઈ, નબળાઈ, સાકડી અથવા ડાધ થવા સામેલ છે. આ ફેરફારો લોહીના પ્રવાહને પ્રતિબંધિત કરી શકે છે. પરિણામે અંગ અને પેશીઓને નુકશાન થાય છે.



* પીઠનો દુઃખાવો :

- સ્નાયુ(તાણ) અથવા અસ્થિબંધન (મયકોડ) ને ઈજા થવાને કારણે પીઠનો દુખાવો (લુભાર બેક એક/ પીઠનો દુઃખાવો) થાય છે. તે કરોડરજજુના નીચલા ભાગને અસર કરતી પીડાદાયક સ્થિતિ છે. સામાન્ય કારણોમાં અચોગ્ય રીતે કંઈક ઉંઘકું, નબળી અંગસ્થિતિ, નિયમિત કસરતનો અભાવ, ફેકચર, ભાંગેલી ડિસ્ક અથવા સંધિવા સામેલ છે.



ટોપાડા કાર્યાલાય (સ્નાયુ શરીરકાર્યાલાય) જે પાઠીની પરિસ્થિતિ છે. એ ત્યારે થાય છે જ્યારે કાંડા અને હાથની પુનરાવર્તિત ગતિ ક્ષારા, તમારા કોણીના કંડરા (tendons) પર વધુ પડતો ભાર આવે છે. તેનું ટેનિસ સંબંધિત નામ હોવા છતાં માત્ર એવા લોકો નથી જેને ટેનિસ એલ્બો ધિક્સે છે.



* ગોલ્ફર્સ એલ્બો :

- ગોલ્ફર્સ એલ્બો એ એવી પરિસ્થિતિ છે કે જેમાં કોણીની અંદર ના બોની બમ્પ સાથે તમારા શાથના સ્નાયુઓના કંડરા (tendons) જોડાય છે ત્યાં પીડા થાય છે. પીડા કદાચ તમારા હાથ અને કાંડામાં ફેલાય શકે છે. ગોલ્ફર એલ્બો , ટેનિસ એલ્બો જેવું વ છે. જે કોણીની બહારના ભાગમાં થાય છે.



* બુસાઈટીસ :

- બુસાઈટીસ એ એક પીડાદાયક પરિસ્થિતિ છે, જે નાની પ્રવાહીથી ભરેલી કોથળીને અસર કરે છે. જેને બૃસા કહેવામાં આવે છે. જે તમારા સાંભાની નજીકના હાડકાં, કંડરા અને સ્નાયુઓને ચાદી આપે છે.
- બુસાઈટીસ એ બુસાસ પ્રવાહીથી ભરેલી કોથળીઓનો સલજો છે. જે હાડકાં વચ્ચેના ધર્ષણને ઘટાડે છે. બુસાઈટીસના સોથી સામાન્ય સ્થાનો ખબા, કોણી અને નિતંબ છે. દા.ત. ઓલેકેનોન બુસાઈટીસ. જ્યારે કોણીની ટોચ પર પ્રવાહીથી ભરેલી કોથળી


અથવા બુસિમાં સોજે થાય છે ત્યારે એલ્બો (ઓલેકેનોન) બુસાઈટીસ થાય છે.



* રિકેટ્સ :


- આ પિકાર પિટામીન D કેલિશયમ અથવા ફોસ્ફેટની કમીને કારણે થાય છે. જેના પરિણામે હાડકા નરમ અને નબળા થઈ જાય છે. જે બાળકોમાં રિકેટ્સ હોય છે તેમાં એક લાક્ષણિક લક્ષણ એ છે કે પગના હાડકાં ઝ્રેલાં કમાન આકારે બહાર વળેલા) હોય છે. રિકેટ્સ બાચ્યાવસ્થામાં અથવા બાળપણ દરમિયાન રૂપદ્ધ થાય છે.

તમે જોઈ શકો છો કે જ્યારે કોઈ વ્યકિત ને રિકેટ થાય છે ત્યારે હાડકાંનો આકાર ડેવી રીતે બદલાય છે.



* ઓસ્ટીયોપોરોસિસ :

- ઓસ્ટીયોપોરોસિસ એ હાડકાંનો રોગ છે. અ. ત્યારે થાય છે જ્યારે શરીર ખૂબ અસ્થિ (હાડકાં) ગુમાવે છે કે ખૂબ ઓછી અસ્થિ બનાવે વે અથવા બંને થઈ શકે છે. પરિણામે હાડકાં બરક, પાતળા અને નરમ બને છે. આ નાજુક હાડકાં સરળતાથસ તૂટી શકે છે અને તે કારે છે અને પતન થવાનું શરૂ કરે છે. જોકે વૃદ્ધિ લોકો (ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ) માં ઓસ્ટીયોપોરોસિસ સામાન્ય છે.
- ઓસ્ટીયોપોરોસિસ એટલે “ઇછ્રાળું હાડકું”



જેમ જેમ આ મહિલા વૃદ્ધ થઈ, તેણીમાં ઓસ્ટીયોપોરોસિસ પિકારિત થતું જેના કારણે તેણીનું કરોડ ક્ષરવા લાયું અને પતન પામ્યું હતું અને તેથી તેણી હવે કમરે થી વળેલી રહે છે.

રૂમેટિક (સંધિવા) રોગોનાં કારણો



એવા ઘણા જોખમ પરિબળો છે. જે રૂમેટિક (સંધિવા) રોગોનું કારણ બને છે. જેક કે

● બિન નિયંત્રિત પરિબળો :

- લિંગ : સંધિવાના રોગોનું સ્ત્રીઓમાં જોખમ વધુ હોય છે. સંધિવા, સ્કલેરોડર્મા, ફાઇબ્રોમાયેલ્જ્યા અને લ્યુપસ થવાની સંભાવના પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ હોય છે. ગાઉટ અને સ્પોન્ડિલોઓથ્રોપેથી પુરુષોમાં વધુ જોવા મળે છે.



- આનુવંશિક : કેટલાક પ્રકારની સંધિવા એક પેઢીથી નીજુ પેઢીમાં આનુવંશિક રૂપે તબદીલ થઈ શકે છે. સાંઘાના અતિશય તાણા સાથે મળીને વારસાગત કાર્ટિલેજની નબળાઈ, અસ્થિવાનાં પિકાસમાં ભૂમિકા ભજવી છે.



- રોગપ્રતિકારક તંત્રના મુદ્દાઓ : તે સ્વચંપ્રતિરક્ષા પિકારનું કારણ બને છે.



- હોર્મોન્સ (અંતઃસ્ત્રાવ) :



- ઉંમર : નાના પુખ્ત વચ્ચના લોકો કરતાં વૃ વયસ્કોમાં અસ્થિવા વધારે જોવા મળે છે.



● નિયંત્રણ પરિબળો :

- ઈજા : ઈજાઓ અથવા પાછળી ઈજા થી પણ પોસ્ટ-ટ્રોમેટિક સંધિવા થઈ શકે છે.



Injury

- જીવનશૈલી : જીવનશૈલી પ્રકાર અથવા અગાઉની તબીબી સ્થિતિ ક્ષારા પણ સંધિવા થઈ શકે છે.



Lifestyle

- અસામાન્ય ચચ્ચાપચ્ચા : અસામાન્ય ચચ્ચાપચ્ચા વજન વધારવામાં અને મેદસ્વીપણામાં પરિણામે છે. જે સંધિવાના રોગોની શરૂઆત અને પ્રગતિને ઉત્તેજીત કરી શકે છે.



Abnormal metabolism



obesity

- ધૂમ્પણાન : સ્થૂળતા અને ધૂમ્પણાન કરવાથી તમને સંખ્યાબંધ ઝેટિક (સંધિવા)ની બીમારીઓનું જોખમ વધે છે.




smoking

- આહાર : આહાર પરિબળો ચોક્કસ સંધિવા રોગો માટેનું જોખમ વબારે અથવા ઘટાડે છે. ગાઉટ, પ્યુરિનવાળા ઉરચ આહાર સાથે સંકળાયેલું છે. જે બિધિધ પ્રકારના માંસમાં જોવા મળે છે. સ્વસ્થ આહાર લો.



- ચેપ : ચેપએ માઈક્રોબિયલ એજન્ટોને લીધે થાય છે. આ પિથિદ્ય પ્રકારના સંધિવા રોગો તરફ દોરી શકે છે.



- વ્યવસાય : કામ કે વ્યવસાય કે જેમાં સાંધારોને વારંવાર વાળવા કે બેસવા માટે થતો હોથ તે સંધિવા રોગો તરફ દોરી શકે છે.



● પર્યાવરણીય પરિબળો :



● ડ્રેટિક (સંધિવા) રોગોના લક્ષણો :

આ આર્થરાઇટીસ રોગોની આસિયત છે.

- સંધિવા માટે, સોજો સામાન્ય રીતે સાંધારમાં એક અથવા વધુ લક્ષણોનું કારણ બને છે. જેમાં સામેલ છે.

- દુખાવો



- વહેલી સવારની જડતા / અર્ટ્રો મોન્ડિંગ સ્ટીફનેસ (EMS) જે અડઘો કલાકથી વધુ ચાલે છે.



- સાંધારોનો સોજો



- આરામ છ્ણારા રાહત થતી નથી



- ગરમાહટ અને લાલાશ



- નરમાશ




- ગતિની ઘટતી શ્રેણી : સામાન્ય રીતે સાંધાનો ઉપયોગ કરવામાં મુશ્કેલી



- રૂમેટોઇડ આર્થરાઇટિસ રોગો પિખિધ પ્રકારના અન્ય લક્ષણો પેદા કરી શકે છે, જેમ કે :
- થાક



- રૂમેટોઇડ નોકચુલ્સ



- એનિમિયા



- આંખમાં બળતરા તથા ચેપ



- ફોલ્લીઓ અને ઘા



- ગળા, કરોડરજ્જુ અથવા પીડમાં દુખાવો




- શ્વાસ લેવામાં મુશ્કેલી



- સ્નાયુમાં દુખાવો



સંધિવા રોગોની અસર



સંધિવા રોગને નિદાન :

કોઈ એક પિશાષ્ટ પરીક્ષણ સંધિવા રોગો (ઇમેટોઇડ આર્થરાઇટીસ) માટે નથી.

- CBC (Complete Blood Count) સંપૂર્ણ રક્ત ગણતરી પરીક્ષણ
- સામેલ સંધાના રેડિયોગ્રાફીક્સ
- CT/MRI સ્કેન
- ડાયરેક્ટ આર્થોસ્કોપી
- સાઇનોપિથિલ / ફલુઇડ એસ્પાથરેટ
- સાથળોપિથિલ મેન્બરની બાયોપ્સી
- આર્થોસેન્ટીસિસ્સ

સંધિવા રોગની સારવાર માટે સૂચનો

સંધિવા રોગોના તીવ્ર પીડાથી રાહત મેળવવા માટે નીચે આપેલ સૂચનો મદદ કરે છે.

- **વજન ઓછું કરવું : સ્થૂળતા ઓછી કરવી**



- **નિયમિત કસરતો કરો**



- **દયાન કરો**



- **તંદુરસ્તાહાર લો**

Healthy Eating



- ધૂમપાન અને મધ્યપાન જેવી ખરાબ આદતો છોડો



- વધારે બેસી રહેવું નહીં



- પૂરતી ઊંઘ લેવી



- પ્રારંભિક લક્ષણોને અવગણાવા નહીં



- દવાથી સારવાર



- વધુ દવા લેવી નહીં



- તમારા ડોક્ટરની સલાહ લો અને યોગ્ય દવા લો



ડ્ર્યુમેટોલોજિસ્ટ

ડ્ર્યુમેટોલોજિસ્ટ - ચિકિત્સકો કે જેમણે સંધિવાની યોગ્ય તાલીમ લીધી હોય તેઓને ડ્ર્યુમેટોલોજિસ્ટ કહેવામાં આવે છે. ડ્ર્યુમેટોલોજિસ્ટ મુખ્યત્વે મન્દિરાંદ્રુલોઝીકેલેટલ સિસ્ટમ ને લગતા રોગો, નરમ પેશીઓ. સ્વયંપ્રતિરક્ષા (ઓટોઇભિન્યુન) રોગો, વાસ્ક્યુલિટાઇઝસના રોગ પ્રતિકારકતા - મદ્યસ્થ પિકારો અને વારસાગત કનેક્ટિવ પેશી પિકાર સાથે સંબંધિત છે.



ડ્ર્યુમેટોલોજિસ્ટ તમારી પરિસ્થિતિનું નિદાન કરવા માટે તમારી તપાસ કરશે અને તે પછી તમારા માટે એક સારવાર યોજનાની બનાવશે જેમાં સંભવત દવાઓ. નિયમિત વ્યાયામ, તંદુરસ્ત આહાર, તાણા વ્યવસ્થાપન અને આરામ સામેલ હશે.

ડ્ર્યુમેટોઇઝ આર્થ્રોઇટીસ અવેરનેસ ડે : ૨ ફેલ્બુઆરી

વર્લ્ડ ચંગ ડ્ર્યુમેટિક ડિસિન્ડિસ ડે : ૧૮ માર્ચ

વર્લ્ડ ટ્યુપસ ડે : ૧૦ મે

વર્લ્ડ ઓટોઇભિન્યુન ઓટોઇઝિલેમેટરી આર્થ્રોઇટીસ ડે : ૨૦ મે

વર્લ્ડ આર્થ્રોઇટીસ ડે : ૧૨ ઓક્ટોબર

તાવ, થાક સાથે સાંઘાના દુખાવાને અવગણાશો નહીં :
ડ્ર્યુમેટોઇઝ આર્થ્રોઇટીસ



સંધિવાના દુખાવામાંથી રાહત

ઉત્પાદક તરફથી (From Manufacturer) :